

તામીલનાડુના હર્બલ જડીબુટ્ટીનો પાવડર બનાવનાર વેપારી પાસે લાખો રૂપિયાનો હર્બલ પાવડર સુરત મંગાવી નાણા ન ચુકવી, છેતરપીંડી કરનાર આરોપીને ઝડપી પાડી, ચીંટીંગનો તમામ હર્બલ જડીબુટ્ટી પાવડર ઝડપી પાડતી, કાઇમ બ્રાંચ.

તામીલનાડુના જી.કૃષ્ણગીરીના સીપકોટ પો.સ્ટે. ગુ.ર.નં. ૩૪૬/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૦૬ મુજબનો ગુનો તા.૧૬/૦૮/૨૦૧૯ના રોજ જાહેર થયેલ જેમાં ફરી.શ્રીનાઓ ઉપર ગયા જુન મહિનામાં એક અજાણ્યા ઇસમે મો.નં.૭૬૦૦૮૯૭૬૩૫ ઉપરથી ફોન કરી જણાવેલ કે, પોતે ગુજરાત, સુરત શહેર ખાતે આવેલ શંખેશ્વર પ્રાશ્નનાથ જૈન મંદિરનો ટ્રસ્ટી છે અને તેઓને આયુર્વેદિક દવા બનાવવા માટે જડીબુટ્ટીના પાવડરની જરૂર છે. એ રીતેની વાતો કરી ફરી.શ્રીને વિશ્વાસમાં લઈ હર્બલ જડીબુટ્ટીનો પાવડરનો ઓર્ડર ટ્રસ્ટના લેટરપેડ ઉપર વોટસેપ કરતા ફરી.શ્રીએ પહેલા મારા મોબાઇલ નંબર પર ઓર્ડર મોકલી આપતા ફરી.શ્રી તેની વાતમાં આવી ગયેલા અને પોતાના પરીચિત જૈન મિત્રોનાં સપર્ક કરતા 'જૈન ટ્રસ્ટ છે તો તમો ચિંતા ન કરો, જૈન ટ્રસ્ટ ચલાવવા વાળા લોકો વિશ્વાસુ હોય છે.' તેવો અભિપ્રાય મળતા ફરી.શ્રીને આ અજાણ્યા ઇસમ ઉપર ભરોસો બેસતા તેણે આપેલ ઓર્ડર મુજબ જુદી જુદી હર્બલ જડીબુટ્ટીનો પાવડર કુલ્લે રૂપિયા ૧૧,૦૫,૧૩૧/- તેના જણાવેલ સરનામે શ્રી શંખેશ્વર પ્રાશ્નનાથ જૈન પેડી મંદિર, શેત્રુંજય એપાર્ટમેન્ટ, ગોપીપુરા, કાજી મેદાન, સુરત ખાતે ટ્રાન્સપોર્ટ મારફતે મારા મોબાઇલ નંબર પર મોકલી આપેલ હતો. આરોપીને મારા મોબાઇલ નંબર પર મોકલી આપેલ હતો સદર ગુનો દાખલ થતા આજરોજ તામીલનાડુ સીપકોટ પો.સ્ટે.ના પોલીસ અધિકારી/માણસો અત્રે સુરત શહેર ખાતે આવી ગુનાની હકીકતથી માહિતગાર કરતા કાઇમ બ્રાંચના પો.સ.ઇ. શ્રી વી.જે.ચાવડા નાઓએ ટીમના પોલીસ માણસો સાથે મજકુર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરેલ હતા. તે દરમિયાન હે.કો.હરીસિંહ વિરસંગભાઈ તથા હે.કો.હરપાલસિંહ જશુભા નાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી કમલેશ ઓગડમલ બંસલ રહે, ગોપીપુરા, કાજીનું મેદાન, સ્મીતા એપાર્ટમેન્ટ, પહેલા માળે સુરતવાળાને ગોપીપુરા, સુભાષચોક ખાતેથી ઝડપી પાડી તેણે ચીંટીંગ કરી મેળવેલ તમામ હર્બલ જડીબુટ્ટી પાવડર કતારગામ, દરવાજા, કુબેરનગર સોસાયટીમાં એક મકાન ભાડે રાખી છુપાવેલ હોવાની કરેલ કબુલાત આધારે તામીલનાડુ પોલીસે ગુનાના કામનો તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.